

12 MARKETS

Ubs Principal Capital Asia sells IndusInd Bank shares for ₹148 cr

UBS PRINCIPAL CAPITAL Asia on Tuesday sold shares of Ind-

usInd Bank worth nearly ₹148 crore through an open market transaction. On BSE, 23 lakh scrips of the private lender were sold at an average price of

₹642.85 apiece. This translated into a deal value of ₹147.85 cr. IndusInd Bank shares were purchased by BofA Securities Europe SA at the same price. —PTI

SUZLON ENERGY LIMITED

(CIN: L40100GJ1995PLC025447)

Regd. Office: "Suzlon", 5, Shrimati Society, Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad-380009; Tel.: +91-79-6604 5000; Fax: +91-79-2656 5540; website: www.suzlon.com; email id: investors@suzlon.com

NOTICE

Notice is hereby given pursuant to Regulation 29 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of the Company will be held on Tuesday, 10th November 2020 to, inter alia, consider and approve the unaudited Financial Results of the Company on Standalone and Consolidated basis for the quarter ended on 30th September 2020.

For Suzlon Energy Limited
Sd/-
Geetanjali S.Vaidya,
Company Secretary.

3rd November 2020
Pune



LOYAL equipments limited

(CIN: L29190GJ2007PLC050607)

Regd. Office: Block No. 35/1-2-3-4, Village-Zak, Dahegam, Gandhinagar-382330, Gujarat, India. Tel No.: +91-2718-247236, Fax No.: +91-2718-269033
E-mail: cs@loyalequipments.com, Website: www.loyalequipments.com

NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 & 33 read with Regulation 47 and other applicable regulations of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of Loyal Equipments Limited is scheduled to be held on Wednesday, November 11, 2020 at 2.00 P.M. at the registered office of the Company situated at Block No. 35/1-2-3-4 Village - Zak, Dahegam, Gandhinagar - 382330 Gujarat, India, inter-alia to consider and approve the Un-Audited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and half year ended on September 30, 2020 and to take on record Limited Review Report thereon. The said notice may be accessed on the Company's website at www.loyalequipments.com and also on the website of BSE Limited at www.bseindia.com.

For Loyal Equipments Limited

Sd/- Rameshchandra Nathalal Patel

Place : Dahegam, Gujarat

Date : 03-11-2020

(Chairman & Whole Time Director)

(DIN : 01307699)



BLS International Services Limited

CIN: L51909DL1983PLC016907

Regd. Office: G-4, B-1, Extension, Mohan Co-operative Industrial Estate, Mathura Road, New Delhi-110044.
Tel. No.: 011-45795002 Fax: 011-23755264 Email: compliance@blsinternational.net, Website: www.blsinternational.com

Statement of Unaudited Consolidated & Standalone Financial Results for the Quarter and Half Year ended September 30, 2020

Consolidated financial results:-

Particulars	Quarter Ended			Half Year Ended			(Rs. In Lakhs)
	September 30, 2020	June 30, 2020	September 30, 2019	September 30, 2020	September 30, 2019	March 31, 2020	
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	
Total Income from Operations	13,122.84	5,214.37	20,359.02	18,337.21	43,054.88	78,613.54	
Net Profit for the period (before tax & exceptional items)	1,438.63	390.45	2,654.56	1,829.09	5,237.96	8,264.20	
Net Profit for the period (after tax & exceptional items)	1,388.07	(79.74)	95.98	1,308.34	2,287.08	5,237.94	
Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	683.59	(44.54)	624.47	639.06	2,548.67	7,454.64	
Paid Up Equity Share Capital (Face Value Re. 1/- each)	1,024.50	1,024.50	1,024.50	1,024.50	1,024.50	1,024.50	
Earning per Share (EPS)(not Annualised)							
(a) Basic EPS - Rs.	1.35	(0.08)	0.09	1.28	2.23	5.11	
(a) Diluted EPS - Rs.	1.35	(0.08)	0.09	1.28	2.23	5.11	

Notes:

1. Key Standalone financial information is as under :-

Particulars	Quarter Ended			Half Year Ended			Year Ended
	September 30, 2020	June 30, 2020	September 30, 2019	September 30, 2020	September 30, 2019	March 31, 2020	
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	
Total Income from Operations	441.99	315.15	1,376.76	757.14	2,712.33	5,312.80	
Net Profit for the period (before tax & exceptional items)	(177.25)	2,492.74	475.49	2,315.49	2,495.82	2,953.16	
Net Profit for the period (after tax & exceptional items)	(173.11)	2,058.20	297.17	1,885.09	1,966.10	2,307.14	
Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(171.17)	2,060.14	295.86	1,888.98	1,963.61	2,322.51	

2. The above un-audited results have been reviewed by the Audit Committee of the Board and taken on record at the meeting of the Board of Directors held on 3rd November, 2020. The Statutory Auditor of the company have carried out limited review as required under SEBI (Listing Obligations and Disclosure Requirements), 2015 and the related report is being submitted to the concerned stock exchanges.
3. In 2018-19, the Group has recognized profit of Rs. 3,382.80 lakhs on sale of fixed assets by three subsidiaries (namely BLS E-Services Private Limited, BLS IT-Services Private Limited and BLS E-Solutions Private Limited). However, confirmation from Punjab Government is awaited.
4. The WHO declared COVID 19 outbreak Pandemic, responding to which the various governments across the world including Govt. Of India has taken serious measures to contain the spread of the Virus by imposing "Lockdowns". The Lockdown has severely affected the International Travel and therefore our Visa Services operations have been severely affected since the last fortnight of March 2020. The Operations of Punjab Seva Kendra, Consular Services and Bank correspondence businesses are back to Pre-COVID levels. The group has implemented various measures to reduce the impact of COVID-19 on its operations.

Franklin generate

FE BUREAU

Mumbai, November 3

THE DEBT SCHEMES of Franklin Templeton Mutual Fund, shut in April, continue to witness cash flow. The six schemes have received ₹438 crore between October 16 and 29. The fund house on Tuesday said from April 24, the total cash received was ₹8,741 crore from maturities, pre-payments, and coupon payments.

The fund house in a statement said the cash available stood at ₹5,441 crore as of October 29 for the four cash-positive schemes, subject to fund-running expenses. Individually, Franklin India Ultra Short Bond Fund, Franklin India Low Duration Fund, Franklin India Dynamic Accrual Fund and Franklin

NFL sees ste

FE BUREAU

New Delhi, October 3

IN ORDER TO promote the balanced use of fertilisers in the country, National Fertilizers (NFL) is encouraging farmers to use non-urea fertilisers like DAP, MoP, NPK and sulphur based fertilizers. With these efforts, the company has registered growth



P

L

SHORT TERM

For and on behalf of
Qualification Bid received upto 3.
Superintending Engineer
641 001 for Conservation
Village, Udumalpet
be opened on the 5th of November 2020.
All other detail corrections etc., to

DIPR / 4120 / TEI

SAN

Regd. Office: 412, I
Mumbai - 400 001

EXTRACTS OF

MERCANTILE VENTURES LIMITED
CIN: L65191TN1985PLC037303
Regd. Office: 88, Mount Road, Guindy, Chennai - 600 032
Website: www.mercantileventures.co.in
Email: admin@mercantileventures.co.in

NOTICE

NOTICE is hereby given pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a Meeting of the Board of Directors of the Company will be held on Thursday, the 12 November 2020 to consider and approve, inter alia, the Unaudited Financial Results of the Company for the second quarter ended 30 September 2020.

This intimation will be made available in the website of Bombay Stock Exchange Limited (www.bseindia.com) and in the website of the Company.

For Mercantile Ventures Limited

E N Rangaswami
(DIN: 06463753)

Place : Chennai Whole-Time Director
Date : 04.11.2020

SUZLON ENERGY LIMITED
(CIN: L40100GJ1995PLC025447)

Regd. Office: "Suzlon", 5, Shrimali Society, Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad-380009; Tel.: +91.79.6604 5000; Fax: +91.79.2656 5540; website: www.suzlon.com; email id: investors@suzlon.com

NOTICE

Notice is hereby given pursuant to Regulation 29 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of the Company will be held on Tuesday, 10th November 2020 to, inter alia, consider and approve the unaudited Financial Results of the Company on Standalone and Consolidated basis for the quarter ended on 30th September 2020.

For Suzlon Energy Limited
Sd/-
Geetanjali S.Vaidya,
Company Secretary.

3rd November 2020
Pune

RIDDHI SIDDHI GLUCO BIOLS LIMITED

CIN: L24110GJ1990PLC013967

Regd. Office: 10, Abhishree Corporate Park, Nr. Swagat Bungalows BRTS Busstand, Ambli-Bopal Road, Ambli, Ahmedabad, Gujarat-380058.
Phone: 02717-298600-602, email: ahmd@riddhisiddhi.co.in

NOTICE

Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is Scheduled to be held on Tuesday, 10th November, 2020, to, inter alia, consider and approve the unaudited standalone and consolidated financial results of the Company for the quarter and half year ended 30th September, 2020.

The said notice may be accessed at the Company's website at www.riddhisiddhi.co.in and of Stock Exchange's website at www.bseindia.com.

For Riddhi Siddhi Gluco Biols Limited
Sd/- Sharad Jain
Company Secretary
Mem. No. A57221

Place: Ahmedabad
Date: 02/11/2020



AuSom Enterprise Limited

Regd. Office: - 11-B, New Ahmedabad Industrial Estate, Village:- Moraiya, Sarkhej-Bavla Road, Ahmedabad-382 213.

CIN : L67190GJ1984PLC006746

Phone : +91 79 2642 1422-1499 Fax : +91 79 2656 9898

E-mail : ausom.ael@gmail.com Website : www. ausom.in

NOTICE

Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Tuesday, the 10th day of November, 2020 at 12:30 p.m. at 606, 'Swagat', Near Lal Bungalow, C.G. Road, Ahmedabad-380 006., inter alia, to consider and approve the Standalone and Consolidated Un-audited Financial Results for the 2nd Quarter and Half year ended on 30th September, 2020.

Further, this information is also available on website of the Company i.e. www.ausom.in and on the website of Stock Exchange's at www.bseindia.com, www.nseindia.com.

For AUSOM ENTERPRISE LIMITED

Sd/-

Yogesh Ghatge
Company Secretary

Place: Ahmedabad
Date : 03/11/2020

એડ-શોપ ઇ-રીટેલ લિમીટેડ

(એડ-શોપ પ્રમોશન્સ લિમીટેડ તરીકે અગાઉ જાણીતી)

CIN: L51109GJ2013PLC076482

રજીસ્ટર્ડ ઓફિસ : બી-૩૦૪, ઈમ્પીરીયલ હાઈટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ,

રાજકોટ-૩૬૦૦૦૫ ઇ-મેઈલ આઈડી : investors@addshop.co

ફોન : 0281-2580399 વેબસાઈટ : www.addshop.co

નોટીસ

આથી સૂચિત કરવામાં આવે છે કે એડ-શોપ ઇ-રીટેલ લિમીટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ બુધવાર, ૧૧મી નવેમ્બર, ૨૦૨૦ના રોજ કંપનીના રજીસ્ટર્ડ ઓફિસે બી-૩૦૪, ઈમ્પીરીયલ હાઈટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫, ગુજરાત ખાતે કંપનીમાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પુરા થતા નિમાસિક અને અર્ધવાર્ષિક અનઓડિટેડ નાણાકિય પરિણામો તેમજ કોઈ અન્ય બાબત જે ચેરમેનશ્રીની મંજૂરીથી રજૂ થાય તેની નોંધ લેવા અને મંજૂર કરવા માટે યોજાયે છે. આ બાબતની માહિતી કંપનીની વેબસાઈટ www.addshop.co અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે.

એડ-શોપ ઇ-રીટેલ લિમીટેડ વતી
સહી/-

દિનેશ બી. પંડ્યા

મેનેજિંગ ડિરેક્ટર (DIN: 06647303)

તા : ૦૩.૧૧.૨૦૨૦
સ્થળ : રાજકોટ

ઇન્ડિયન બેંક



Indian Bank

શાખા : યુનિવર્સિટી રોડ, રાજકોટ
"એમ્બીશન" ફૂટ રીંગ રોડ, ઈન્દિરા સર્કલ, રાજકોટ
ટેલિ. નં. : ૦૨૮૧ - ૨૫૮૬૦૭૧

ઈ-હરાજી નોટીસ

અચલિત મિલકતોના વેચાણ માટે (જુઓ રૂલ નં. ૮ (5))

સિકયોરીટી ઇન્વેસ્ટમેન્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(5) ની જોગવાઈઓ સાથે વંચતા સિકયોરીટી ઇન્વેસ્ટમેન્ટ અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિકયોરીટી ઇન્વેસ્ટમેન્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાપર મિલકતોના વેચાણ માટે

જાહેર જનતાને સામાન્ય રીતે અને કચ્છદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો આ નોટિસથી જણાવવામાં આવે છે કે નીચે વર્ણવેલ સ્થાપર મિલકત જે સિકયોરીટી ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટર પાસે ગિરવે/ચાર્જ રાખેલ છે જેનો ભૌતિક/સાંકેતિક કબજો ઇન્ડિયન બેંક, સિકયોરીટી ઇન્વેસ્ટમેન્ટ અધિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે એનું 'જેમ છે જ્યાં છે', 'જે છે તે છે' અને 'જે કાંઈ છે તે છે'ના આધારે નીચે આપેલ તારીખે જે તે કચ્છદાર/રો અને જામીનદાર/રો, ગીરોદાર/રો પાસેથી સિકયોરીટી ઇન્વેસ્ટમેન્ટ લેવાની થતી રકમની વસૂલાત માટે વેચાણ થશે. ટ્રિપલ કિંમત, અર્નર્સ્ટ મની ડિપોઝીટ અને સ્થાપર મિલકતનું ટૂંકમાં વર્ણન પણ નીચે આપેલ છે. "સિકયોરીટી અસ્ત્યામતો છોડાવવાની ઉપલબ્ધ સમય મર્યાદા અને કાયદાના સેક્શન ૧૩ના સબ-સેક્શન(૮) તરફ કચ્છદારનું ધ્યાન દોરવામાં આવે છે."

ક્રમ નં.	ઉદ્ધારકર્તાઓ / જામીનદારો / મોર્ગેજરોનું નામ અને શાખાનું નામ	મિલકતનું વિગતવાર વર્ણન	સુરક્ષિત બાકી રકમ	વિગ્રહ કિંમત
૧	શ્રી જયસન વિનોદભાઈ સીદાપરા (અરજદાર) શ્રી જયસન વિનોદભાઈ સીદાપરા (અરજદાર/જામીનદાર) કાન્તાબેન વી. સીદાપરા (જામીનદાર) શાખા : યુનિવર્સિટી રોડ	ગામ હરિપર (પાલ) આર એસ નં. ૫૬/૧-૭ પૈકીના ડ્રીન હીલ્સ પાર્ક તરીકે જાણીતો એરીયા વિ. રાજકોટ, ગુજરાત ખાતે આવેલ કુલ ૫૮૮.૫૩ ચો મી. માપની જમીન પરના પ્લોટ નં. ૮ અને ૯ પરની જમીન પર બંધાયેલ રોયલ હોસ્ટેલ નામના મકાનના રથા માળ પર ૫૩.૨૪ ચો મી. માપની જમીન પરના રહેણાંક ફ્લેટ નં. ૪૦૧ વાળી મિલકતના બંધા પાર્ટ અને પાર્સલ. ચતુ:સીમા - ઉત્તર : માર્ગનું જગ્યા પછી રોડ, દક્ષિણ : સીડી અને ફ્લેટ નં. ૪૦૨, પૂર્વ : માર્ગનું જગ્યા પછી રોડ, પશ્ચિમ : ફ્લેટ નં. ૪૦૪.	Rs. 12,88,138.87 તા. ૦૧.૦૮.૨૦૧૬ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જિસ અને અન્ય ખર્ચાઓ.	Rs. 17.20 Lacs
૨	શ્રી હરીગોમ મેટલ્સ (દેવાદાર) શ્રી મોહીક બી. ઉપાધ્યાય (દેવાદાર અને ગીરવેદાર) શ્રીમતી ઝરના ઉપાધ્યાય (સહ-દેવાદાર અને જામીનદાર) શ્રી ભદ્રીક ઉપાધ્યાય (જામીનદાર) શ્રી રજનીકાંત જયસુભાવ વ્યાસ (જામીનદાર અને ગીરવેદાર) શાખા : યુનિવર્સિટી રોડ	મિલકત ૧ : ફ્લેટ નં. ૩૨, ૩૩ માળ, શ્રી એપાર્ટમેન્ટ, પ્લોટ નં. ૧૬૬/૪ અને ૧૭૦ પૈકી આર એસ નં. ૪૩૧ અને ૪૩૨ પૈકી સીએસડબલ્યુ નં. ૧૫, સીએસ નં. ૨૭૬૫, રેલવે ટ્રેક્સ સામે, પ્રિયા એપાર્ટમેન્ટ અને અજમેરા એપાર્ટમેન્ટ પાસે સરદારનગર એરીયા રાજકોટ. ચતુ:સીમા - ઉત્તર : અન્યની મિલકત, દક્ષિણ : પેસેજ, પૂર્વ : ફ્લેટ નં. ૩૩, પશ્ચિમ : ફ્લેટ નં. ૩૧ અને સીડી. મિલકત ૨ : બ્લોક અને પ્લોટ નં. ૪૫-૫૪/૧૧, આર એસ નં. ૩૮૩, પી૩, વૃંદાવન પાર્ક-૪ "આવકાર રેસીડેન્સી", દિવ્યા કોટન જીનીંગ પાછળ ઓફ ગોડલ બાય પાસે, જેતપુર તરફ, ગોડલ. ચતુ:સીમા - ઉત્તર : પ્લોટ નં. ૪૫ થી ૫૪/૧૦ની મિલકત તે બાજુનું માપ ૧૩-૮૦ મી છે, દક્ષિણ : પ્લોટ નં. ૪૫ થી ૫૪/૧૦ની મિલકત તે બાજુનું માપ ૧૩-૮૦ મી છે, પૂર્વ : ૭-૫૦ મીટર પહોળો રોડ તે બાજુનું માપ ૩-૭૮ મી છે. પશ્ચિમ : પ્લોટ નં. ૩૦ થી ૪૭/૬.	Rs. 4634200.00 તા. ૨૨.૦૬.૨૦૧૬ની ડિમાન્ડ નોટીસ મુજબ + જે તે તારીખ સુધીનું વ્યાજ અને ખર્ચા, ચાર્જિસ અને અન્ય ખર્ચાઓ.	Rs.11.76 Lacs & Rs. 15.78 Lacs

અર્નર્સ્ટ મની ડિપોઝીટ : ૧૦% રીપર્વ કિંમતના

શરતો અને નિયમોની